

Seat No. : _____

SM-127

September-2020

B.A., Sem.-VI

**CC-315 : ECONOMICS
(Economics Essays – 02)
(New Syllabus)**

Time : 2 Hours]

[Max. Marks : 50

સ્વીકારો : (1) બધા જ નિબંધોના ગુણ સરખા છે.
(2) નીચેનામાંથી કોઈપણ બે નિબંધ લખો.

- | | |
|--|-----------|
| 1. ગાંધીજીના આર્થિક વિચારો. | 25 |
| 2. ભારતીય કરમાળખું અને કરસુધારણા. | 25 |
| 3. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વैશ્વિકરણની નીતિઓ. | 25 |
| 4. ભારતમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો. | 25 |
| 5. ભારતમાં શહેરીકરણની સમસ્યા. | 25 |
| 6. ભારતમાં પર્યાવરણ અને પ્રદૂષણની સમસ્યા અને ઉપાયો. | 25 |

Seat No. : _____

SM-127

September-2020

B.A., Sem.-VI

CC-315 : ECONOMICS (Economics Essays – 02) (New Syllabus)

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :** (1) All **Essays** carry equal marks.
(2) Write any **TWO** essays from the following.

- | | |
|---|-----------|
| 1. Gandhian Economic Thoughts. | 25 |
| 2. Tax Structure and Tax Reforms in India. | 25 |
| 3. Liberalization, Privatization and Globalization Policies in India. | 25 |
| 4. Nationalized Banks and Private Banks in India. | 25 |
| 5. Urbanization problem in India. | 25 |
| 6. Environment and Pollution problems in India and solutions. | 25 |

Seat No. : _____

SM-127

September-2020

B.A., Sem.-VI

CC-315 : ECONOMICS (Economics Essays – 02) (Old Syllabus)

Time : 2 Hours]

[Max. Marks : 50

સ્વીકાર્યના : (1) બધા જ નિબંધોના ગુણ સરખા છે.
(2) નીચેનામાંથી કોઈપણ બે નિબંધ લખો.

1. ભારતમાં સમાંતર અર્થતંત્ર.	25
2. ભારતમાં બાળમજૂરી.	25
3. ભારતમાં સામાજિક સલામતી.	25
4. ભારતમાં એકમલાક્ષી ધિરાણ અને સૂક્ષ્મ વીમો.	25
5. ભારતમાં રેઝુલેટરી સંસ્થાઓ : SEBI, TRAI, IRDA, ERC.	25
6. ભારતમાં શહેરીકરણ અને સ્થળાંતર.	25

Seat No. : _____

SM-127

September-2020

B.A., Sem.-VI

CC-315 : ECONOMICS (Economics Essays – 02) (Old Syllabus)

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :** (1) All **Essays** carry equal marks.
(2) Write any **TWO** essays from the following.

- | | |
|--|-----------|
| 1. Parallel Economy in India. | 25 |
| 2. Child Labour in India. | 25 |
| 3. Social Security in India. | 25 |
| 4. Micro Credit and Micro Insurance in India. | 25 |
| 5. Regulatory agencies in India : SEBI, TRAI, IRDA, ERC. | 25 |
| 6. Urbanization and Migration in India. | 25 |

Seat No. : _____

SM-127

September-2020

B.A., Sem.-VI

CC-315 : ECONOMICS (Ganitbaddh Arthshastra) (Old Course)

Time : 2 Hours]

[Max. Marks : 50

- સૂચના : (1) વિભાગ - Iના તમામ પ્રશ્નોનાં ગુણ એકસરખા (14) છે.
(2) વિભાગ - Iમાં 8માંથી કોઈપણ ત્રણ પ્રશ્નો લખો.
(3) વિભાગ - IIનો પ્રશ્ન નંબર 9 ફરજીયત છે. જેમાં 8માંથી 4 MCQ લખો. પ્રત્યેકનાં 2 ગુણ.

વિભાગ - I

1. અર્થમિતિશાસ્ત્ર એટલે શું ? અર્થમિતિશાસ્ત્રનું સ્વરૂપ, કાર્યક્ષેત્ર અને પદ્ધતિ ચર્ચો. 14
2. (A) પ્રકાર-I અને પ્રકાર-II ની ભૂલો વિશે નોંધ લખો. 7
(B) બિંદુ આગામન અને અંતરાલ આગામન વિશે નોંધ લખો. 7
3. સમાચિત નિયતસંબંધ વિધેય અને નિદર્શ નિયતસંબંધ વિધેય એટલે શું ? ન્યૂનતમ વર્ગ આગામન પદ્ધતિ સમજાવો. 14
4. (A) નિર્ણાયક સહસંબંધાંક (r^2) વિશે નોંધ લખો. 7
(B) શ્રેષ્ઠ, સુરેખ, અનબિનત આગામનોના ગુણાધર્મો જણાવો. 7
5. બહુચલીય સમરેખતાની સમસ્યા શું છે ? તેના કારણો અને પરિણામો વિશે ચર્ચા કરો. 14

6. (A) શ્રેણીગત સહસંબંધ વિશે નોંધ લખો. 7
(B) તુટીપદના વિષમ વિચરણ વિશે નોંધ લખો. 7

7. નીચે આપેલા બજાર મોડેલની ફ્રમ અને કક્ષાની શરતો વડે અભિજ્ઞેયતા ચકાસો :

$$D = a_0 + a_1 P_1 + a_2 P_2 + a_3 y + a_4 t + u$$

$$S = b_0 + b_1 P_1 + b_2 P_2 + b_3 c + b_4 t + w$$

$$D = 5$$

જ્યાં,

D, S, P_1 આંતરિક ચલરાશિ છે.

P_2 , y, t, c બાધ્યગત ચલરાશિ છે.

u, w તુટીપદ છે.

14

8. (A) હુસ્ટાનીય ન્યૂનતમ વર્ગા પદ્ધતિ વિશે નોંધ લખો. 7
(B) કેર્નસનું આવક નિર્ધારણ મોડેલ ઉદાહરણ આપીને સમજાવો. 7

વિભાગ - II

9. બહુવૈકળ્પિક પસંદગીનાં ગ્રશ્મો (8માંથી 4 લખો) : (પ્રત્યેક ગ્રશ્મનાં 2 માર્ક્સ)

(1) જો નિરાકરણીય પરિકલ્પના (H_0) સાચી હોય, અને તેનો અસ્વીકાર થાય, તો -

- (a) સાચો નિર્ણય
- (b) પ્રકાર-2 ની ભૂલ
- (c) પ્રકાર-1 ની ભૂલ
- (d) પ્રકાર-3 ની ભૂલ

(2) જો નિરાકરણીય પરિકલ્પના (H_0) ખોટી હોય, અને તેનો સ્વીકાર કરીએ, તો

- (a) સાચો નિર્ણય
- (b) પ્રકાર-2 ની ભૂલ
- (c) પ્રકાર-1 ની ભૂલ
- (d) પ્રકાર-3 ની ભૂલ

(3) નિદર્શા આગણકની અનભિનતતા માટે -

(a) $E(\hat{\theta}) = \theta$

(b) $P(|\hat{\theta} - \theta| < \epsilon) \rightarrow 1$ જ્યારે $n \rightarrow \infty$

(c) $\text{Var}(\hat{\theta}) \leq \text{var}(\hat{\theta}^*)$

(d) ઉપરનું એકપણ નહિ

(4) નીચેનામાંથી કયું નિદર્શા નિયતસંબંધ સમીકરણ છે ?

(a) $e = y - \hat{y}$

(b) $\hat{y} = b_0 + \hat{b}_1 X$

(c) $y = \hat{b}_0 + \hat{b}_1 X + e_i$

(d) $y = b_0 + b_1 X + u$

(5) નીચેનામાંથી કઈ ધારણાનો ભંગ થવાથી તુટીપદના વિષમ વિચરણની સમસ્યા ઉદ્ભવે છે ?

(a) $\text{Cov}(u_i u_j) = 0$

(b) $E(u^2) = \sigma_u^2$

(c) $r_{x_1 x_2} \neq 1$

(d) ઉપરનું એકેય નહિ

(6) નીચેનામાંથી કઈ ધારણાનો ભંગ થવાથી શ્રેષ્ઠીગત સહસંબંધની સમસ્યા ઉદ્ભવે છે ?

- (a) $\text{Cov}(u_i u_j) = 0$
- (b) $r_{x_1 x_2} \neq 1$
- (c) $E(u^2) = \sigma_u^2$
- (d) ઉપરનું એકપણ નહિ

(7) મોડેલ અને અવલોકિત આંકડાકીય માહિતી સાથે સુસંગત હોય, તેવી પરિકલ્પના નક્કી કરવી એટલે

- (a) યુગાપત સમીકરણ પદ્ધતિ
- (b) ક્રિસ્ટરીય ન્યૂનતમ વર્ગ પદ્ધતિ
- (c) અભિજ્ઞાન
- (d) પરોક્ષ ન્યૂનતમ વર્ગ પદ્ધતિ

(8) ચલના સંયુક્ત આધાર વર્ણવતી પદ્ધતિ એટલે શું ?

- (a) યુગાપત સમીકરણ પદ્ધતિ
 - (b) અભિજ્ઞાન
 - (c) ક્રિસ્ટરીય ન્યૂનતમ વર્ગ પદ્ધતિ
 - (d) ઉપરનું એકપણ નહિ
-

Seat No. : _____

SM-127

September-2020

B.A., Sem.-VI

CC-315 : ECONOMICS (Ganitbaddh Arthshastra) (Old Course)

Time : 2 Hours

[Max. Marks : 50]

- Instructions :**
- (1) All questions in **Section – I** carry equal marks **(14)**.
 - (2) Attempt any **THREE** questions out of **eight** in **Section – I**.
 - (3) Question No. **9 (Nine)** in **Section – II** is **COMPULSORY**. Write any **4 (four)** MCQ out of **8 (eight)**. Each MCQ question carry **2 (two)** marks.

Section – I

1. What is Econometrics ? Explain nature, scope and method of Econometrics. **14**

2. (A) Write short note on Type-I and Type-II Error. **7**
(B) Write short note on Point estimation and Interval estimation. **7**

3. What is Population Regression function and sample Regression function ? Explain least square estimation method. **14**

4. (A) Write short note on coefficient of determination (r^2) **7**
(B) State the properties of Best, Linear, Unbiased Estimator (BLUE). **7**

5. What is the problem of Multi-collinearity ? Discuss its reasons and consequences. **14**

6. (A) Write short note on Auto Correlation. 7
 (B) Write short note on Heteroscedasticity. 7

7. Test Identification of the following market model by using Rank and Order condition :

$$D = a_0 + a_1 P_1 + a_2 P_2 + a_3 y + a_4 t + u$$

$$S = b_0 + b_1 P_1 + b_2 P_2 + b_3 c + b_4 t + w$$

$$D = 5$$

Where D, S, P₁ is endogenous variables

P₂, y, t, c exogenous variables,

u, w error term.

14

8. (A) Write short note on two-stage least square method. 7
 (B) Explain Keynes' Income determination model with the help of an example. 7

Section – II

9. Multiple Choice Questions (Write any 4 out of 8). (Each question carry 2 marks.) 8

- (1) If null hypothesis (H₀) is true and we reject it then

- (a) True decision
- (b) Type-2 error
- (c) Type-1 error
- (d) Type-3 error

- (2) If null hypothesis (H₀) is wrong and we accept it, then it is

- (a) True decision
- (b) Type-2 error
- (c) Type-1 error
- (d) Type-3 error

(3) For unbiasedness of sample estimator

(a) $E(\hat{\theta}) = \theta$

(b) $P(|\hat{\theta} - \theta| < \epsilon) \rightarrow 1$ when $n \rightarrow \infty$

(c) $\text{Var}(\hat{\theta}) \leq \text{var}(\hat{\theta}^*)$

(d) None of the above

(4) Which of the following is the sample regression equation ?

(a) $e = y - \hat{y}$

(b) $\hat{y} = b_0 + \hat{b}_1 X$

(c) $y = \hat{b}_0 + \hat{b}_1 X + e_i$

(d) $y = b_0 + b_1 X + u$

(5) Which assumption is broken when Heteroscedasticity of error term problem is created ?

(a) $\text{Cov}(u_i u_j) = 0$

(b) $E(u^2) = \sigma_u^2$

(c) $r_{x_1 x_2} \neq 1$

(d) None of the above

(6) Which assumption is broken when Autocorrelation problem is create ?

- (a) $\text{Cov}(u_i u_j) = 0$
- (b) $r_{x_1 x_2} \neq 1$
- (c) $E(u^2) = \sigma_u^2$
- (d) None of the above

(7) Determine a hypothesis which is consistent with model and observed statistical information means

- (a) Simultaneous equation method
- (b) Two-stage least square method
- (c) Identification
- (d) Indirect least square method

(8) What is the method describing combine dependence of variable ?

- (a) Simultaneous equation method
 - (b) Identification
 - (c) Two-stage least square method
 - (d) None of the above
-